



ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા

Gujarati Literary Academy of North America

4 Ales Place, Wayne, NJ 07470 Phone 973-628-8269 Fax 973-696-7338
Email: ramgadhavi@glaoafna.com Web: www.glaoafna.com

**Executive
Committee
2016-2019**

30 જૂન, 2018

મિત્રો,

PRESIDENT
Ram Gadhavi

આપણું અગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન સપ્ટેમ્બર 7-8-9, 2018 દરમિયાન ઈસ્ટ હૅનોવર, ન્યુ જર્સીમાં યોજાય છે. એમાં હાજરી આપવા આપને હાર્દિક આમંત્રણ છે.

VICE PRESIDENT
Dr. Jayesh Shah

આ સંમેલન માટે આપણે સાહિત્ય જગતમાં સુપ્રસિદ્ધ શ્રી રમણ સોની, શ્રી મણીલાલ હ. પટેલ, શ્રી ઇલા આરબ મહેતા, શ્રી મુકેશ જોશી, શ્રી સૌમ્ય જોશી અને શ્રી અપૂર્વ આશરને આમંત્ર્યાં છે. સાહિત્યલક્ષી મનોરંજન માટે સુપ્રસિદ્ધ કલાકારો શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, શ્રી જાક્વિ શ્રીમાનકર અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણીને પણ આમંત્ર્યાં છે.

SECRETARY
Jaswant Mody

સંમેલન વિશેની પ્રાથમિક માહિતી આ સાથે મોકલીએ છીએ જેમાં સંમેલનનું રજિસ્ટ્રેશન ફોર્મ, હોટેલ રૂમ રિઝર્વેશનની માહિતી અને એકેડેમીના સભ્ય થવા ઇચ્છતા આપના મિત્રો માટેનું ફોર્મ પણ છે. આ જ માહિતી અને દરેક જરૂરી ફોર્મ એકેડેમીની વેબસાઇટ www.glaoafna.com પર પણ મળશે.

TREASURER
Gaurang Mehta

MEMBERS-AT-LARGE

Dr. Darshana Jhala
Gini Malaviya
Harish Ravaliya

સંમેલનના વહેલા રજિસ્ટ્રેશનના ઘટાડેલા દરનો લાભ લેવા આપનું ફોર્મ વહેલામાં વહેલી તકે – પણ શુક્રવાર, **24 ઓગસ્ટ, 2018 પહેલાં અચૂક** – અમને પહોંચાડશે. એ પછી મળેલાં રજિસ્ટ્રેશન વધારેલા દરથી જ થઈ શકશે. પરદેશથી ખાસ આમંત્રિત સાહિત્યકારો સિવાયની સંમેલનમાં આવતી દરેક વ્યક્તિ – વક્તા અને શ્રોતા – માટે રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.

**CO-OP
MEMBERS**

Ashish Desai
Rathin Mehta

આ કોન્ફરન્સ સેન્ટરની ક્ષમતા પ્રમાણે રજિસ્ટ્રેશન અમૂક સંખ્યા પર પહોંચ્યા પછી બંધ કરવાની અમને ફરજ પડશે. આપનું રજિસ્ટ્રેશન વહેલામાં વહેલી તકે મોકલી આપવા વિનંતિ છે.

સંમેલનની હોટેલ Fairbridge Hotel and Conference Center, East Hanover, NJમાં રૂમ રિઝર્વેશન કરવા આ સાથેની માહિતી જોશો. એમાં દર્શાવેલો સંમેલન માટેનો ખાસ દર મેળવવા હોટેલ સાથે સીધો સંપર્ક કરવો.

એકેડેમીના કાર્યક્રમોની અને બીજી જાહેરાતો ફક્ત ઈ-મેઇલથી મોકલીએ છીએ. એ માટે આપનું ઈ-મેઇલ સરનામું ramgadhavi@glaoafna.com પર પહોંચાડવા વિનંતિ છે. એવી ઈ-મેઇલમાં આપનું ટપાલ સરનામું પણ મોકલશો જેથી સરખા નામવાળા બીજા સભ્યની માહિતી સાથે આપનું ઈ-મેઇલ સરનામું જોડાઈ ન જાય. આ સેવા ફક્ત એકેડેમીના સભ્યોને માટે જ છે.

સંમેલનનો વિગતવાર કાર્યક્રમ થોડા સમયમાં ઈ-મેઇલથી મોકલવા ધારીએ છીએ.

સંમેલનમાં જરૂર મળીએ એવી આશા રાખું છું.

આપનો વિશ્વાસુ,
રામ ગઢવી

